

- ૧) સાફલ્ય ગાથા (ફોટાઓ સાથે)
- ૨) સુરક્ષા સેતુ અંતર્ગત થયેલ કાર્યક્રમો તથા તેને અનુરૂપ ફોટાઓ વિગત વૃષ્ટરોપણ કાર્યક્રમ વિજલપોર પોલીસ સ્ટેશન.



ચોરી કરેલ મોબાઇલ સાથે બે ઇસમોને પકડી પાડતી એલ.સી.બી. નવસારી

(૧) સાજીદ અનવર ખાન રહે.નવસારી, તિઘરા નવીવસાહત (૨) ઇમામ ઉર્ફે સલમાન શાબીર શેખ રહે.નવસારી તિઘરા નવીવસાહતનાઓને કોર્ડન કરી પકડી પાડી (૧) સાજીદ અનવર ખાન રહે.નવસારી, તિઘરા નવીવસાહતની ઝડતી કરતાં તેના ખીસ્સામાંથી એ.ટી.સી કંપનીનો મોડલ નં.એચ.ટી.સી ડીઝાયર ૮૨૦ મોબાઇલ ફોન કી.રૂ.૬,૦૦૦/-નો મળી આવેલ તેમજ (૨) ઇમામ ઉર્ફે સલમાન શાબીર શેખ રહે.નવસારી તિઘરા નવીવસાહતની ઝડતી કરતાં તેના ખીસ્સામાંથી વીવો કંપનીનો મોડલ નં.વાય-૫૧ એલનો મોબાઇલ ફોન કી.રૂ.૧૦,૦૦૦/-નો મળી આવેલ હોય આ બન્ને ઇસમોની પુછપરછ કરતાં આ બન્ને મોબાઇલ ફોન કી.રૂ.૧૬,૦૦૦/-ના ચોરી અગર છળકપટથી મેળવેલ હોવાનું જણાય આવેલ હોય જે બન્ને ઇસમોને તા.૧૭/૦૭/૨૦૧૬ના રોજ પકડી પાડી આગળની કાર્યવાહી માટે નવસારી ટાઉન પો.સ્ટેને સોંપેલ છે.

મુદા નંબર (૧)

૧. જીલ્લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય, કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ.
- નવસારી જીલ્લા પોલીસ ધ્વારા વર્ષ ૨૦૦૭ થી આજદિન સુધીના ગુમ થયેલ બાળકો/વ્યક્તિઓ શોધવા અંગે મીસીંગ ડ્રાઇવનું આયોજન કરી સગા સંબંધીનો સંપર્ક કરી શોધવાની કામગીરી કરવામાં આવે છે.
- ગુમ/અપહરણ થયેલ બાળકોની ભારત સહકાર ધ્વારા શરૂ કરવામાં આવેલ વેબસાઇટ [http:// trackthemissingchild.gov.in/ missing/ index.php](http://trackthemissingchild.gov.in/missing/index.php) ઉપર રોજ રોજ એન્ટ્રી કરવામાં આવે છે.
- પી.સી.આર. વાન ચીખલી, બીલીમોરા, નવાસરી ટાઉન વિસ્તાર, નવસારી ડુરલ, જલાલપોર વિસ્તારમાં તાલીમ બદ્ધ ડ્રાયવરો તેમજ પોલીસ કર્મચારીઓ મુકી શરૂ કરી ૧૦૦ નંબર પર કોલ કરવાથી હેલ્પ મળી રહે.
- ગુમ થયેલ બાળકો અંગે જીલ્લાની મહીલા સુરક્ષા સમિતીની મહીલાઓ તેમજ એન.જી.ઓ. યાઇલ્ડ વેલ્ફેર ઓફીસર તેમજ જીલ્લાના તમામ અધિકારીઓ સાથે મીટીંગો કરવામાં આવે છે.

મુદા નંબર (૩)

- ટ્રાફિક અંગેના કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ હોય.
- ટ્રાફિક સપ્તાહની ઉવજણી કરવામાં આવી રહેલ છે. ટ્રાફિક અવેરનસ અંગે શાળા કોલેજોમાં કાર્યક્રમો કરવામાં આવે છે.
- ટ્રાફિક જનજાગૃતિ અંગે ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી ટ્રાફિકના નિયમો સાથેની જાહેર જગ્યાઓ તેમજ શાળા કોલેજોમાં આર.ટી.ઓની મદદથી અવેરનસ કાર્યક્રમો રાખવામાં આવેલ.
- વારંવાર રોડ ઉપર ટ્રાફિક ડ્રાઇવ રાખી ટ્રાફિક અવેરનસ અંગેની સમજ આપવામાં આવે છે.

મુદા નંબર (૪)

- ગુનાઓ અટકાવવા કોઈ વિશિષ્ટ કામગીરી/સ્પેટેજી અપનાવવામાં આવેલ છે ?
- નેશનલ ૮ તેમજ અન્ય રસ્તાઓ ઉપર એક્સીડન્ટ ઝોન નક્કી કરી રોડ એક્સીડન્ટ, ટ્રાફિક નિયમન, કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારુ સી.સી.ટી.વી. કેમેરાની જરૂરીયાત મુજબની યાદી બનાવી કલેક્ટરશ્રી સાથે મિટીંગો કરવામાં આવેલ છે.
- જીલ્લાના નવસારી ટાઉન-૨ નવસારી ટુરલ- ૧૬, ચીખલી-૩૭, બીલીમોરા - ૨૩, ઉમરાટ, - ૮, દાંડી-૨ કેમેરા સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ સીસીટીવી કેમેરા કાર્યરત કરવામાં આવેલ છે.
- નેશનલ હાઇવે નંબર ૮ ઉપર નાઇટ રાઉન્ડ દરમિયાન સેક્ટરવાઇઝ કોસ પેટ્રોલીંગ કરવામાં આવે છે. હોટલો, ઢાબા, તેમજ વાહનોનું ચેકીંગ સઘન બનાવવામાં આવેલ છે.
- વારંવાર કોમ્પીંગ નાઇટ રાખી શક પડતા ઇસમો, અવાવડુ જગ્યા, રેલવે સ્ટેશન, હોટલ ધાબા, વાહન ચેકીંગ તેમજ નાકાબંધી રાખવામાં આવેલ છે.
- કાઇમ ઇન્સ્વેસ્ટીગ અંગે પોલીસના માણસોને સેમિનાર યોજી ગુનાઓ અટકાવવા તેમજ ઇન્સ્વેસ્ટીગમાં અવેરનસ આવે તે સારુ સેમિનારો યોજમાં આવે છે. ક્ષમતા વિકાસનું દરેક પોલીસ સ્ટેશન લેવલે આયોજન કરવામાં આવે છે.

મુદા નંબર (૫)

- અન્ય લોકહિતની બાબતો જે લોકોના તુરતજ ધ્યાન પર આવે તેવી બાબતો.
- સુરક્ષા સેતુ સોસાયટીના ભાગરૂપે એસ.પી.સી. ના બાળકોને વિવિધ પ્રકારની તાલીમ કેમ્પ, સેમિનારનું આયોજન કરવામાં આવે છે.
- નેશનલ હાઇવે નંબર ૮ તેમજ અન્ય રસ્તાઓ ઉપર એક્સીડન્ટ ઝોન કક્કી કરી રોડ એક્સીડન્ટ, ટ્રાફિક નિયમન, કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારુ સી.સી.ટી.વી. કેમેરાની જરૂરીયાત મુજબની યાદી બનાવી કલેક્ટરશ્રી સાથે મિટીંગો ગોઠવવામાં આવેલ છે.
- જીલ્લાના નવસારી ટાઉન વિસ્તારમાં આવેલ ટ્રાફિક નિયમ, કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ સીક્યુરીટી સીસ્ટમ અને સી.સી.ટી.વી. કેમેરાની વ્યવસ્થાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.